

S.Ow.No. 987/Lunch Menu for March Month/2025-26

Date:-27/02/2026

Freedom Valley School - Lunch Menu for March 2026 (Std Nursery to 12th)

Date	Day	Menu	મેનુ	Remarks
01-03-2026	Sunday	Holiday (Weekend)	રજા (રાવવાર)	
02-03-2026	Monday	Daal, Rice, Sev Khaman, Sweet Vermicelli	દાળ, ભાત, સેવ ખમણ, સેવઈ	
03-03-2026	Tuesday	Holiday (Holi)	રજા (હોળી)	
04-03-2026	Wednesday	Holiday (Dhuleti)	રજા (ધૂળટી)	
05-03-2026	Thursday	Veg. Khichadi, Kadhi, Handvo	વેજ ખીચડી, કઢો, હાંડવો	
06-03-2026	Friday	Daal, Rice, Roti, Shakkariya-Bataka	દાળ, ભાત, રોટલી, શક્કરીયા બટાકા	
07-03-2026	Saturday	Paneer Tikka Masala, Paratha, Salad, Chhas	પનીર ટીક્કા મસાલા પરાઠા, સલાડ, છાસ	
08-03-2026	Sunday	Holiday (Weekend)	રજા (રાવવાર)	
09-03-2026	Monday	Gravy Rajma, Chapati, Jira Rice, Buttermilk	ગ્રેવી રાજમા, ચપાટી, જીરા રાઈસ, છાસ	
10-03-2026	Tuesday	Ringan Masala, Bhakhri, Kadhi, Rice, Plain Daal	રોંગણ મસાલા, ભાખરી, કઢો, ભાત, મોળો દાળ	
11-03-2026	Wednesday	Pav Bhaji with Salad	પાઉભાજી, સલાડ	
12-03-2026	Thursday	Khichdi, Kadhi, Kapuriya	ખીચડી, કઢો, કપુરિયા	
13-03-2026	Friday	Daal, Rice, Dudhi Tomato Potato, Roti	દાળ-ભાત, દુધી, ટામેટા-બટાકા, રોટલી	
14-03-2026	Saturday	Methi Thepla, Lasaniya Bataka, Lemon Rice, Chhas	મેથીના થેપલા, લસણીયા બટાકા, લેમન રાઈસ, છાસ	
15-03-2026	Sunday	Holiday (Weekend)	રજા (રાવવાર)	
16-03-2026	Monday	Vaal ni Daal, Kadhi, Rice & Masala Rotla	વાલ ની દાળ, કઢો, ભાત, મસાલા રોટલા	
17-03-2026	Tuesday	Capsicum Aloo, Kadhi, Rice, Plain Daal	કપ્સીકમ આલુ, કઢો, ભાત, મોળો દાળ	
18-03-2026	Wednesday	Daal Dhokadi, Steam Rice, Salad, Chhas	દાળઢોકડો, સ્ટીમરાઈસ, સલાડ, છાસ	
19-03-2026	Thursday	Veg. Fada Khichdi, Kadhi, Muthiya	વેજ ફાડા ખીચડી, કઢો, મુઠીયા	
20-03-2026	Friday	Daal, Rice, Guvarsing, Roti	દાળ, ભાત, ગુવારસીંગ, રોટલી	
21-03-2026	Saturday	Annual Function (Nursery to 3th)		
22-03-2026	Sunday	Annual Function (4th Onwards)		
23-03-2026	Monday	Holiday	(રજા)	
24-03-2026	Tuesday	Result & Kit Distribution (Nursery To 3rd)		
25-03-2026	Wednesday	Result & Kit Distribution (4th Onwards)		
26-03-2026	Thursday			
27-03-2026	Friday			
28-03-2026	Saturday			
29-03-2026	Sunday			
30-03-2026	Monday			
31-03-2026	Tuesday			

Spring Break

New Academic Session will Start from 2nd April 2026

- > Jain Food will be provided without Onion, Garlic & Potato on Request.
- > Every morning, provide healthy breakfast to kids, before they leave for school
- > Please send healthy snack from home like fruits, salads or sprouts for Break time.
- > Any Junk food / Dry snacks sent in the Tiffin will not be allowed.
- > Please send one napkin with your child daily
- > Kindly keep a copy of this menu in your kitchen to avoid repetition of the same menu during dinner.
- > The management reserves the right to alter the menu at any time.

Pinakin Patel

Pankaj Sharma

Kitchen In-charge
(Pinakin Patel)

Principal
(Pankaj Sharma)